

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સીટી કાઉન્સિલ પગલાં લે છે વ્યવસાયોને ટેકો આપવા માટે અને COVID-19 સામે લડત આપતા અર્થતંત્રને બેઠું કરવા માટેની યોજના

બ્રેમ્પટન, ઓન્ટારિયો (13 મે 2020) – આજે સિટી કાઉન્સિલે બ્રેમ્પટનનાં અર્થતંત્રને પુનર્જીવન આપવા માટેના વ્યુહને સિટી માટેના માળખા તરીકે અનુમોદન આપ્યું જેથી સ્થાનિક અર્થતંત્રને પુનઃ શરૂ કરી આગળ વધી શકાય.

નાના વ્યવસાયોની હિમાયત

બ્રેમ્પટનનાં લઘુ વ્યવસાયો ધરાવતા સમુદાય પર થયેલ COVID-19ના પ્રભાવ સામેના પ્રતિભાવ તરીકે જેમાં મહેસૂલમાં ખોટ અને કબજો પાછો લેવાની ચાલુ રહેલ ધમકીઓનો સમાવેશ થાય છે ત્યારે મેયર બ્રાઉને કમર્શ્યલ એવિક્શન એટલેકે ધંધાદારીઓને કબજો પાછો આપવાની સૂચનાઓ પર લંગામી ધોરણે પ્રતિબંધ ફરમાવવા માટે પ્રોવિન્શ્યલ સરકારને વિનંતીનો પત્ર જારી કર્યો છે. જે વ્યવસાયો કેનેડા ઇમર્જન્સી કમર્શ્યલ રેન્ટ અસિસ્ટન્સ (CECRA) પ્રોગ્રામની મંજૂરીઓની પ્રતિક્ષા કરતા હોય તેઓને આ ટૂંકી અવધિનું નિરાકરણ રાહત આપશે.

સિટી બ્રેમ્પટનમાં મકાનમાલિકોને CECRA માં અરજી કરવા પ્રોત્સાહિત કરે છે અને ભાડા ચુકવણીની યોજનાઓ પર ભાડુઆતો સાથે વાતચીત કરવા વિચાર કરવા જણાવે છે જેથી તેમને આ પડકારરૂપ સમયમાં મદદ મળી શકે.

ઇકોનોમિક રિકવરી સ્ટ્રેટજી

ઇકોનોમિક રિકવરી સ્ટ્રેટજીને મેયરના COVID-19 ઇકોનોમી સપોર્ટ ટાસ્ક ફોર્સનું માર્ગદર્શન સાંપડ્યું હતું જેના સહ પ્રમુખ પટે રિજનલ કાઉન્સિલરો માઈકલ પલેશી અને પૉલ વિસેન્ટ બીરાજે છે અને જેઓ COVID-19 ની મહામારીમાં બ્રેમ્પટન આખામાં વ્યવસાય રાહત પ્રયાસોને મદદરૂપ થવા માટેના પગલાં અને ભલામણોનું સંકલન કરવા કાર્ય કરી રહ્યા છે. ટાસ્ક ફોર્સમાં ફેડરલ અને પ્રોવિન્શ્યલ સરકારો, બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ અને ડાઉનટાઉન બ્રેમ્પટન BIA, ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ બ્રેમ્પટનનાં વેપારી આલમના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે

ઇકોનોમિક રિકવરી સ્ટ્રેટજીનું લક્ષ્ય બ્રેમ્પટનનું અર્થતંત્ર આગળ ધપી રહ્યું છે ત્યારે તેમાં સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક લાભ મેળવવાનું છે. આ લક્ષ્યો ત્યારે હાંસલ થશે જ્યારે વ્યુહના ચાર સ્તંભો સાથે મેળ ખાય તેમ તાકીદની તેમજ લાંબા ગાળાની કામગીરીઓ આગળ ધપાવવામાં આવે. ચાર સ્તંભો અને કેટલીક તાકીદની કામગીરીઓ નીચે મુજબ છે:

- ઇનોવેશન, ટેકનોલોજી અને સાહસિકતા એટલેકે આન્ત્રપ્રુનરશીપ

ઇનોવેશન અને ટેકનોલોજીના પરિવર્તનને સંપૂર્ણપણે સ્વીકારવું અને સાહસિકતાની વૃત્તિનો લાભ લેવો જે એવી પહેલો મારફત થઈ શકે જેમકે બ્રેમ્પટન આન્ત્રપ્રુન્યોર સેન્ટરના પ્રસ્તાવો અને સત્તાવાર રીતે ડાઉનટાઉન ઇનોવેશન ડિસ્ટ્રિક્ટને શરૂ કરી તેને ઉછેરવું.

- **નિવેશ**
નિવેશ આકર્ષાને તેને રોકી રાખવાની તકો ઝડપી લેવી જેમાં સામેલ છે "સપોર્ટ લોકલ" અભિયાન અને વર્ચ્યુઅલ ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મિશનસ.
- **ઈન્ફ્રાસ્ટ્રક્ચર**
અલગોમા યુનિવર્સિટીના વિસ્તરણ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓને ઝડપથી વધારવી.
- **કલા, સંસ્કૃતિ અને પ્રવાસન**
સિટી જ્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તતા અને કલા તેમજ સંસ્કૃતિના સેક્ટરને મદદરૂપ થવાના ભવિષ્યને નવો વળાંક આપવા ચાહે છે ત્યારે ડિજિટલ ઇનોવેશનના માર્ગે આગળ વધવાનું ચાલુ રાખવું. તાકીદની પહેલોમાં સામેલ છે કલા કેળવણી, પર્ફોર્મન્સ અને ઈવેન્ટ્સની વર્ચ્યુઅલ ડિલિવરી.

સમય જતાં લેવામાં આવતા પગલાંનો અમલ થશે અને મૂલ્યાંકન થશે ત્યારે "વ્યુલ્ડ" યથાર્થ થશે.

અવતરણો

"COVID-19 બ્રમ્પટનના વ્યવસાયો માટે એ જ રીતે એક પ્રચંડ આર્થિક ટાઈડલ વેવ પુરવાર થયો છે જેમ વિશ્વના બીજા તમામ સ્થળો પર પણ થયું છે. આપણે જ્યારે આપણાં અર્થતંત્રને પાછું બેઠું કરવાની યોજના બનાવીએ છીએ ત્યારે અમે આપણા નાના વ્યવસાયો માટે હિમાયત કરવાની કામગીરી ચાલુ રાખી છે. મને આનંદ છે કે ઈકોનોમિક ટાસ્ક ફોર્સનું ધ્યાન સ્થાનિક વ્યવસાયોને તાકીદની સહાય પૂરી પાડીને ફરી બેઠા થવા પર કેન્દ્રિત છે, જેથી આપણે આપણા અર્થતંત્રને ફરી શરૂ કરી શકીએ અને આપણા વ્યવસાયો ફરીથી, બને એટલા જલ્દી બેઠા થઈ જાય તે માટે મદદરૂપ થઈએ."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"આપણે નસીબદાર છીએ કે આપણા વેપારી આલમની સમસ્યાઓની ચર્ચા કરવા અને સંભવિત નિરાકરણો લાવવા માટે ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સની મેજ પર આપણા ઘણાં ભાગીદારો આપણાં જ સમાજના છે જેમાં સામેલ છે મંત્રીશ્રી સરકારિયા અને MP ખેરા. હવે અમે બધાં આપણી વેપારી આલમના સમર્થનમાં ભેગા થયા છીએ અને આ કટોકટીમાંથી જ્યારે બહાર નીકળી રહ્યા છીએ ત્યારે અર્થતંત્રને ફરી બેઠું કરવા આયોજનો કરી રહ્યા છીએ. ખરેખર સાથે રહીને જ મજબૂતી આવશે અને આ પડકારને સાથે મળીને જ ઝીલીશું."

-માઈકલ પલેશી, પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર) વોર્ડ 2 અને 6, સહ પ્રમુખ, ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ

"COVID-19 ની મહામારી શરૂ થઈ ત્યારથી અમે આપણા વેપારી આલમની સાથે જ મેદાનમાં છીએ, તેમની સાથે બેઠકો કરીએ છીએ, હિમાયતો કરીએ છીએ અને અમારાથી થાય એવી બધી જ રીતે એમને મદદરૂપ થઈએ છીએ. અમને આશા છે કે અમે તેમને આ કટોકટીમાંથી હેમખેમ અને સ્થિતિસ્થાપકતા સાથે બહાર કાઢીશું જે નક્કર પગલાં ભરીને થઈ શકશે જેનાથી તેઓને અત્યારે તેમજ ભવિષ્યમાં ટેકો મળતો રહે."

- પૉલ વિસેન્ટ, પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર) વોર્ડ 1 અને 5, સહ પ્રમુખ, ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ

"અમારા કર્મચારીગણ COVID-19 ટાસ્કફોર્સના સદસ્યો સાથે મળીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે જેથી અત્યારે આપણા સ્થાનિક વ્યવસાયોને મદદ મળે જે તેઓના ભાવિ વિકાસ અને સફળતાને વેગ આપવામાં મદદરૂપ થશે. સિટી એક અતિ સક્રિય અભિગમ અપનાવી રહ્યા છે જે સુનિશ્ચિત કરે છે કે COVID-19 સામે એક વ્યાપક પ્રતિભાવ ઊભો થાય જેમાં આપણાં સ્થાનિક અર્થતંત્રનાં અનેક સેક્ટરો સંડોવાયેલ છે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca